

AXIS/CO/CS/234/2023-24

July 28, 2023

National Stock Exchange of India Limited  
Exchange Plaza, 5th Floor  
Plot No. C/1, "G" Block  
Bandra-Kurla Complex  
Bandra (E), Mumbai – 400 051

BSE Limited  
1<sup>st</sup> Floor  
P. J. Towers,  
Dalal Street,  
Fort, Mumbai – 400 001

NSE Symbol: AXISBANK

BSE Scrip Code : 532215

Dear Sir(s),

**SUB: Publication of Notice in Newspaper containing Un-audited Financial Results of the Axis Bank Limited ("Bank") for the quarter ended June 30, 2023**

Pursuant to the captioned subject, please find enclosed herewith copies of the newspaper clippings published by the Bank.

This is for your information and records.

Thanking you,

Yours Sincerely,  
For **Axis Bank Limited**

**Sandeep Poddar**  
**Company Secretary**

Encl: As above



**Tata Consumer Products Limited**

Registered Office : 1, Bishop Lefroy Road, Kolkata - 700020  
CIN - L15491WB1962PLC031425

Email : investor.relations@tataconsumer.com, Website : www.tataconsumer.com

**Extract of Consolidated Financial Results for the quarter ended June 30, 2023**

| Particulars   | Three months ended |                |               | Year ended     |
|---|--------------------|----------------|---------------|----------------|
|   | June 30, 2023      | March 31, 2023 | June 30, 2022 | March 31, 2023 |
|   | Unaudited          | Refer Note 3   | Unaudited     | Audited        |
| Total Income from Operations  | 3741.21            | 3618.73        | 3326.83       | 13783.16       |
| Net Profit for the period (before tax and exceptional items)  | 494.60             | 456.45         | 403.45        | 1634.11        |
| Net Profit for the period before tax (after exceptional items)  | 489.44             | 450.08         | 379.48        | 1793.56        |
| Net Profit for the period after tax [after exceptional items and share of profit/(loss) of Associates and Joint Ventures]           | 337.71             | 289.56         | 276.72        | 1320.14        |
| Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 382.80             | 335.55         | 190.62        | 1403.82        |
| Equity share capital (Face value of Re 1 each)  | 92.90              | 92.90          | 92.16         | 92.90          |
| Reserves excluding Revaluation Reserves   |                    |                |               | 16161.95       |
| Earnings per share (not annualised for the quarter)   |                    |                |               |                |
| Basic - Rs  | 3.41               | 2.89           | 2.77          | 13.02          |
| Diluted - Rs  | 3.41               | 2.89           | 2.77          | 13.02          |

Notes:  
1. Additional information on standalone financial results is as follows:

| Particulars                  | Three months ended |                |               | Year ended     |
|------------------------------|--------------------|----------------|---------------|----------------|
|                              | June 30, 2023      | March 31, 2023 | June 30, 2022 | March 31, 2023 |
|                              | Unaudited          | Refer Note 3   | Unaudited     | Audited        |
| Total Income from Operations | 2316.08            | 2177.85        | 2076.88       | 8538.82        |
| Profit before tax            | 374.26             | 330.65         | 307.40        | 1267.37        |
| Profit after tax             | 285.45             | 250.46         | 232.83        | 950.07         |

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the BSE Limited's website (URL: www.bseindia.com), National Stock Exchange of India Limited's website (URL: www.nseindia.com) and on the Company's website (URL: www.tataconsumer.com).  
3. Figures of the quarter ended March 31, 2023 are the balancing figures between audited figures in respect of the full financial year and year to date figures up to the third quarter of the relevant financial year.

Sd/-  
**Sunil D'Souza**  
(Managing Director and CEO)

Place : Mumbai  
Date : July 26, 2023



A COMPANY FOCUSED ON ELECTRONIC PAYMENTS

**R S SOFTWARE (INDIA) LIMITED**

(CIN : L72200WB1987PLC043375)

Registered Office : "FMC Fortuna", 1st Floor, A-2, 234/3A, A.J.C. Bose Road, Kolkata - 700 020  
Phone Nos. : 033 22876254 / 6255 / 5746, Fax No.: 033 22876256, Company's website: www.rssoftware.com

An ISO 9001:2008, ISO 27001: 2013 Company

**STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE PERIOD ENDED 30TH JUNE, 2023**

| Particulars  | Quarter Ended                     |                       |                      | Year ended            |
|--|-----------------------------------|-----------------------|----------------------|-----------------------|
|  | June, 2023 (Audited)              | March, 2023 (Audited) | June, 2022 (Audited) | March, 2023 (Audited) |
|  | Total Income from Operation (net) | 1,107.62              | 1,224.52             | 479.47                |
| Net Profit / (Loss) from ordinary activities after tax                                 | 140.71                            | 93.53                 | (404.56)             | (868.36)              |
| Net Profit / (Loss) for the year after tax (after Extraordinary items)                 | 149.60                            | 97.17                 | (390.52)             | (821.21)              |
| Equity share Capital   | 1,285.42                          | 1,285.42              | 1,285.42             | 1,285.42              |
| Reserve (Excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous Year) | 1,913.17                          | 1,763.25              | 2,236.30             | 1,763.25              |
| <b>Earning per share (before extraordinary item) (of INR 5/- each)</b>                 |                                   |                       |                      |                       |
| Basic  | 0.58                              | 0.38                  | (1.52)               | (3.19)                |
| Diluted  | 0.58                              | 0.38                  | (1.52)               | (3.19)                |
| <b>Earning per share (after extraordinary item) (of INR 5/- each)</b>                  |                                   |                       |                      |                       |
| Basic  | 0.58                              | 0.38                  | (1.52)               | (3.19)                |
| Diluted  | 0.58                              | 0.38                  | (1.52)               | (3.19)                |

**STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE PERIOD ENDED 30TH JUNE, 2023**

| Particulars  | Quarter Ended                     |                       |                      | Year ended            |
|--|-----------------------------------|-----------------------|----------------------|-----------------------|
|  | June, 2023 (Audited)              | March, 2023 (Audited) | June, 2022 (Audited) | March, 2023 (Audited) |
|  | Total Income from Operation (net) | 1107.62               | 1224.52              | 479.47                |
| Net Profit / (Loss) from ordinary activities after tax                                 | 231.10                            | 263.83                | (304.29)             | (406.79)              |
| Net Profit / (Loss) for the year after tax (after Extraordinary items)                 | 231.10                            | 257.24                | (304.29)             | (413.38)              |
| Equity share Capital   | 1285.42                           | 1285.42               | 1285.42              | 1285.42               |
| Reserve (Excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous Year) | 4535.44                           | 4303.03               | 4453.81              | 4303.03               |
| <b>Earning per share (before extraordinary item) (of INR 5/- each)</b>                 |                                   |                       |                      |                       |
| Basic  | 0.90                              | 1.00                  | (1.18)               | (1.61)                |
| Diluted  | 0.90                              | 1.00                  | (1.18)               | (1.61)                |
| <b>Earning per share (after extraordinary item) (of ₹ 5/- each)</b>                    |                                   |                       |                      |                       |
| Basic  | 0.90                              | 1.00                  | (1.18)               | (1.61)                |
| Diluted  | 0.90                              | 1.00                  | (1.18)               | (1.61)                |

Note :  
The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Quarterly / Annual Financial Results are available on the Stock Exchange website (Url . of the fillings  
BSE : [http://www.bseindia.com/corporates/Comp\\_Resultsnew.aspx?expandable=3](http://www.bseindia.com/corporates/Comp_Resultsnew.aspx?expandable=3) ;  
NSE:<http://www.nseindia.com/corporates/corporateHome.html?id=eqFinResults>

On behalf of the Board of Directors of  
**R S Software (India) Limited**

Place : Kolkata  
Dated : July 25, 2023

**R R Jain**  
(Chairman & Managing Director)

**ASSAM ELECTRICITY GRID CORPORATION LIMITED**  
**REQUEST FOR EXPRESSION OF INTEREST**  
No. AEGCL/MD/Tech-291/PP&D/2023/Star Cement/4 Dated: 26.07.2023

|                       |   |
|-----------------------|---|
| Project name          | Repair/Renovation of 220kV Spare Bay (F1) and coupling to the existing GIS at 220kV Sonapur GIS, AEGCL. |
| Type of contract      | Works   |
| Type of notice        | Request for Expression of Interest (REOI)   |
| Extended Closing date | 04.08.2023  |

Interested parties may please visit [www.aegcl.co.in](http://www.aegcl.co.in) for further details.  
T-872/PR/2023/APS/3 Sd/- Chief General Manager (PP&D), AEGCL

**ASSAM ELECTRICITY GRID CORPORATION LIMITED**  
**TIME EXTENSION NOTICE**  
No. AEGCL/MD/Tech-291/PP&D/2023/Sonapur/Bay repair/5 Dated: 26.07.2023

|                       |   |
|-----------------------|---|
| Project Name          | Repair/Renovation of 132kV Narengi feeder Bay at 220kV Sonapur GIS AEGCL. |
| Type of contract      | Works   |
| Type of Notice        | Request for Expression of Interest (REOI)                                 |
| Extended Closing date | 04.08.2023  |

Interested parties may please visit [www.aegcl.co.in](http://www.aegcl.co.in) for further details.  
Sd/-, Chief General Manager, (PP&D), AEGCL

**RAJNANDINI METAL LIMITED**  
Registered Office: Plot No. 344, Sector 3 Phase II, IMT Bawal – 123501 Haryana (India)  
Phone: 01284-264194; Email: [cfo@rajnandinimetal.com](mailto:cfo@rajnandinimetal.com)  
Website: [www.rajnandinimetal.com](http://www.rajnandinimetal.com)  
CIN: L51109HR2010PLC040255

**STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023**

(Amount in Rs. Lakhs)

| Particulars  | Quarter Ended |            | Year ended |            |
|--|---------------|------------|------------|------------|
|  | 30.06.2023    | 31.03.2023 | 30.06.2022 | 31.03.2023 |
|  | Un-Audited    | Audited    | Un-Audited | Audited    |
| 1 Total Income from Operations   | 26,658        | 33,755     | 26,316     | 103,905    |
| 2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)  | 568           | 525        | 552        | 2,112      |
| 3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)   | 568           | 525        | 552        | 2,112      |
| 4 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)  | 459           | 335        | 359        | 1,368      |
| 5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)) | 463           | 335        | 359        | 1,368      |
| 6 Paid up Equity Share Capital   | 2,765         | 2,765      | 1,843      | 2,765      |
| 7 Basic EPS (Face Value of Rs. 10/-)   | 0.17          | 0.12       | 1.94       | 0.50       |
| Diluted EPS (Face Value of Rs. 10/-)   | 0.17          | 0.12       | 1.94       | 0.50       |

Notes:  
1 The above un-audited standalone financial results have been reviewed by the Audit Committee and then taken on record by Board of Directors at their meeting held on 26th July, 2023.  
2 The statutory auditors have carried out limited review of the financial results of the company for the quarter ended June 30, 2023 under regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The Statutory Auditors have expressed an unmodified report of the above results.  
3 The Financial results of the Company has been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) notified by the Ministry Of Corporate Affairs under the Companies (Indian Accounting Standard) Rule, 2015 as amended from time to time, specified in section 133 of Companies Act, 2013.  
4 Tax expenses include current tax, deferred tax and adjustment of taxes for previous years.  
5 The Company is not having any subsidiary, associate or joint venture; therefore its has prepared only standalone results as consolidation requirement is not applicable to the company.  
6 The above Financial results are available on the Companies Website [www.rajnandinimetal.com](http://www.rajnandinimetal.com).  
7 The figures of the previous periods have been regrouped / rearranged / and / or recast wherever found necessary to make them comparable.

By order of the Board  
For Rajnandini Metal Limited  
Sd/-  
**Het Ram Sharma**  
Managing Director  
DIN: 02925990

Date: July 26, 2023  
Place: Bawal

**AXIS BANK LTD.**  
Regd. Office: 'Trishul', 3<sup>rd</sup> floor, Opp. Samaratheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006.  
Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025.  
CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: [shareholders@axisbank.com](mailto:shareholders@axisbank.com)

**UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023**

(₹ in lacs)

| PARTICULARS   | Axis Bank (Standalone)               |                                      |                                      | Axis Bank (Consolidated)             |                                      |                                      |
|---|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|
|   | FOR THE QUARTER ENDED 30.06.2023     | FOR THE YEAR ENDED 31.03.2023        | FOR THE QUARTER ENDED 30.06.2022     | FOR THE QUARTER ENDED 30.06.2023     | FOR THE YEAR ENDED 31.03.2023        | FOR THE QUARTER ENDED 30.06.2022     |
| Total income from operations  | 30,644.04                            | 1,01,307.19                          | 21,657.03                            | 31,894.20                            | 1,05,797.30                          | 22,615.88                            |
| Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)   | 7,779.48                             | 29,395.67                            | 5,527.64                             | 8,191.62                             | 31,111.00                            | 5,882.82                             |
| Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)  | 7,779.48                             | 16,905.85                            | 5,527.64                             | 8,191.62                             | 18,621.18                            | 5,882.82                             |
| Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)   | 5,797.10                             | 9,579.68                             | 4,125.26                             | 6,091.35                             | 10,818.45                            | 4,380.59                             |
| Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         |
| Paid-up equity share capital (Face value ₹2/- per share)  | 615.95                               | 615.37                               | 614.29                               | 615.95                               | 615.37                               | 614.29                               |
| Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year   | 1,24,377.87 (As on 31st March, 2023) | 1,24,377.87 (As on 31st March, 2023) | 1,14,411.51 (As on 31st March, 2022) | 1,28,740.25 (As on 31st March, 2023) | 1,28,740.25 (As on 31st March, 2023) | 1,17,495.94 (As on 31st March, 2022) |
| Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)                            |                                      |                                      |                                      |                                      |                                      |                                      |
| - Basic   | 18.83                                | 31.17                                | 13.43                                | 19.79                                | 35.20                                | 14.27                                |
| - Diluted   | 18.75                                | 31.02                                | 13.40                                | 19.70                                | 35.04                                | 14.23                                |
| Securities Premium Account  | 52,060.52                            | 51,893.22                            | 51,587.22                            |                                      |                                      |                                      |
| Net Worth   | 1,23,808.89                          | 1,17,893.38                          | 1,11,265.20                          |                                      |                                      |                                      |
| Outstanding Debts   | 1,72,176.06                          | 1,86,300.04                          | 1,70,605.17                          |                                      |                                      |                                      |
| Outstanding Redeemable Preference Shares  | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |
| Debt Equity Ratio   | 1.31                                 | 1.49                                 | 1.43                                 |                                      |                                      |                                      |
| Capital Redemption Reserve  | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |
| Debenture Redemption Reserve  | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |

Note:  
1. Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet made applicable to banks.  
2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank ([www.axisbank.com](http://www.axisbank.com)) and on the Stock Exchange websites ([www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com)).  
3. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.

For and on behalf of the Board

Place: Mumbai  
Date: 26<sup>th</sup> July, 2023

**AMITABH CHAUDHRY**  
MD & CEO

[www.axisbank.com](http://www.axisbank.com)





# Tesla eyes Asian mkts with upcoming low-cost model

Co has been cutting prices across its models to attract customers amid high inflation

Alisha Sachdev  
alisha.sachdev@livemint.com  
NEW DELHI

**T**esla, the American automotive company led by billionaire entrepreneur Elon Musk, is eyeing new opportunities in Asia with its cutting-edge 'new-gen platform', which seeks to introduce more budget-friendly compact and sub-compact electric vehicles (EV) that have the potential to drive large volumes across developing Southeast Asian markets.

According to Tesla's Q2 investor deck, it is working on developing its next-generation EV platform across multiple locations. Industry insiders said the new product, which is projected to be priced around \$25,000, may debut by 2023-end, although some analysts expect a 2025 launch.

Currently, Tesla's Shanghai gigafactory, the main export hub and its largest manufacturing facility, ships to Thailand and Singapore and will soon start exporting to Malaysia.


Nonetheless, Tesla faces formidable competition in these territories from China's BYD, which has a dominant position in the emerging EV market in Malaysia and has outperformed Japanese EV makers in this region.

Tesla's access to the markets is via exports, as low volumes do not make it a viable option to set up integrated gigafactories in this region. Besides, Shanghai's 750,000-unit gigafactory, which produces Models 3 and Y, has enough room to ship vehicles to the neighbouring markets.

In its 19 July report, Barclays said it expects Tesla's upcoming affordable

## Affordable access

Tesla is expected to increasingly focus on more sales in mainstream price categories



Source: JATO Dynamics  
SARVESH KUMAR SHARMA/MINT

EV to account for 275,000 deliveries in 2026 and to eventually become twice as large in sales compared to its present volume driver, the Model Y, at 3.5 million units annually by 2030.

This is despite the fact that Model Y is estimated to clock 1.5 million units in sales, and Model 3 990,000 units.

Tesla's manufacturing capacity is at 2.025 million units across its factories in the US, China and Germany (Berlin). Although its largest unit in Shanghai produces 750,000 units, the firm's largest manufacturing base is in the US across two factories in Austin (250,000 units) and Fremont (650,000 units).

"Tesla is well-positioned in the developed world, including North America, Europe, Japan, Korea, Australia and China, but it is not competitive in the developing markets, where income levels are lower, and

Tesla's current prices are not competitive there. In Southeast Asia, Latin America and the Middle East, Tesla isn't competitive against Chinese brands' starting offer in EVs in these regions. A \$25,000 Tesla in India could be interesting, but what would be affordable is an even smaller price tag. Today, EVs in the developed world are facing price issues. Even if Tesla comes up with a \$25,000 EV in India, it won't shake up the market as the Indian consumer's affordability is far less than that," said Felipe Munoz, global automotive analyst, JATO, said in an interview.

In April-June, Tesla's deliveries were up 83% from a year earlier to 466,140 units, out of which 446,915 units were the Model 3 entry-level sedan and the Model Y mid-SUV. Tesla is cutting prices across its range to attract customers in an inflationary

environment.

"Our operating income decreased slightly year-on-year to \$2.4 billion in Q2, resulting in a 9.6% operating margin," Tesla said in its Q2 shareholder deck, indicating that this was due to a lower average selling price following price cuts.

According to brokerage JPMorgan, Tesla is expected to increasingly focus on more sales in "more mainstream price categories".

In India, BYD faces stiff challenges in the wake of the 2020 border clash between Indian and Chinese forces in the Galwan Valley, which led to stricter regulations on foreign direct investment from neighbouring countries sharing land borders. This resulted in heightened scrutiny, and investment proposals from such countries require prior approval from the Centre. Tesla is seizing this opportunity to reinstate discussions with India, despite uncertain growth forecasts in other markets.

While the challenges remain the same from earlier attempts, Tesla is now mulling a manufacturing unit here. With general elections approaching, the government is pushing the company to make firm commitments to its India manufacturing plan. Tesla may get incentives from the government along the lines of the production-linked incentive scheme it offers to the automotive sector.

"Musk has set out on an ambitious goal to achieve 20 million EV sales globally by 2030. To do that, it will need to set up manufacturing capacity and tap demand in some of the world's largest markets, wherein India is a significant piece," said a person privy to Tesla's India operation plans.

# Shoppers Stop to expand affordable fashion footprint

Suneera Tandon  
suneera.t@hrtive.com  
NEW DELHI

**D**epartment store chain Shoppers Stop is set to expand its value format chain Intune to 10 stores from the existing three, to compete with major players like Trent's Zudio and Reliance Trends, strategically targeting the lower-end segment of the apparel market in India.

"It is a small trial that we're doing into that segment. The logic behind it is if you see the market, tier-2 and tier-3 forms the biggest part of the pyramid in terms of retail sales, and if you add to it the unorganized market, it is over 70%. In the last 10-15 years, we have seen the unorganized market moving into organized, typically at the bottom end of the pyramid. Hence, the opportunity for brands to grow in that segment is the prime driver," said Venu Nair, managing director and chief executive of Shoppers Stop, said.

In April-June, the firm opened three Intune format stores: two in Hyderabad and one in Mumbai. "It's a few stores and we know that we need to do multiple stores for us to be able to establish the format, establish the product categories. The plan is to do 10 stores. The remaining will be opened in two-three months," Nair said during a post-earnings interview with Mint.

Value retail typically finds favour with India's middle-income consumers who aspire to wear branded clothes, but do not have a budget to buy established foreign brands. The new format will sell pri-



The co plans to expand its value format chain Intune to 10 stores in coming months. MINT

vate labels but not follow the Shoppers Stop format under which it also retails third-party brands. The outlets will also be smaller, focussing on affordable products for women, children and men. It will be 100% private label driven; and hence it plays into our private brand strategy, Nair added.

On Tuesday, the company said its profit after tax for the three months ended 30 June fell 41% from the year earlier to ₹13 crore, while sales grew 4% to ₹1,241 crore.

Apparel business saw a moderation and operating environment remains challenging, the company said added. For the near-term, retail will continue to witness rebalancing of price-volume growth equation and a gradual recovery in demand, it added.

Demand for apparel retail moderated since Diwali 2022, said Nair. It is broadly in line with the slowdown seen across other discretionary categories. Inflationary pressures are still persisting, and is being especially felt in the mass market segments, Nair added.

**During the June quarter, Shoppers Stop opened 3 stores under the 'Intune' format; 2 in Hyderabad and one in Mumbai**

**2.025 mn**  
Tesla's current manufacturing capacity

**83%**  
y-o-y rise in Tesla's total deliveries in April-June qtr

# ICC World Cup date change may spark hotel cancellations

Varuni Khosla  
varuni.k@livemint.com  
NEW DELHI



The India-Pakistan match will be held in Ahmedabad.

**T**he likely change of date to the much-anticipated ICC Cricket World Cup clash between India and Pakistan, which was scheduled for 15 October in Ahmedabad may trigger panic cancellations, or date change request from fans who booked flights and hotels to the venue at exorbitant prices, said industry insiders.

While the situation is evolving, some hotels are preparing for a rise in distress calls from customers this coming week. Reports suggest the Board of Control for Cricket in India (BCCI) may advance the match date to 14 October, as Navratri festivals will begin across most states on 15 October.

However, any alteration to the match date could be challenging for Pakistan as it faces Sri Lanka in Hyderabad on 12 October. Besides, two matches have already been scheduled for 14 October: one between New Zealand and Bangladesh at the MA Chidambaram Stadium in Chennai, and the other featuring England and Afghanistan at Arun Jaitley Stadium in Delhi.

A hotel chain, which runs three properties in Ahmedabad, said it is yet to receive any cancellation requests, but should it occur, it plans to consider advancing bookings by a day. However, the final action will depend on BCCI's official announcement. It is also considering shifting non-World Cup related bookings to more distant hotels, its general manager said. Its room rate for the match date is around ₹75,000.

A month ago, when World Cup schedule was announced, most hotels, including home-

stays, had taken an over 100% price hike in their asking room rate. Prices of 5-stars hotels had gone up from ₹5,000-8,000 a night to ₹40,000 to ₹1 lakh for 15 October. The India-Pakistan match will be held at Narendra Modi Stadium, which accommodates 100,000 spectators. The tickets for the match will be available for ₹3,000-₹3 lakh.

According to a senior BCCI official its decision on the date change will be announced on Wednesday.

As of 26 July, one-way flights between Delhi and Ahmedabad in economy class start at ₹24,000. Flights to Ahmedabad from Mumbai and Kolkata, are available for ₹13,000-15,000.

It also doesn't help that the match falls right in the middle of festivities in India, when airfares traditionally tend to be higher. Airfares may rise even more if the date of the match is changed. According to Airport Authority of India, Ahmedabad is the seventh busiest airport in India, ferrying around 5.67 million people in FY22.

In FY22, Ahmedabad had a supply of 3,586 hotel rooms, across Marriott, Taj, ITC Narmada, Hyatt and Lemon Tree Hotels, a report by hospitality consultancy Hotelivate said.

**According to a senior BCCI official its decision on the date change will be announced on Wednesday**

## AXIS BANK LTD.

Regd. Office: 'Trishul', 3<sup>rd</sup> floor, Opp. Samaratheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006.  
Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025.  
CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

### UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30<sup>TH</sup> JUNE, 2023

| PARTICULARS  | Axis Bank (Standalone)               |                                      |                                      | Axis Bank (Consolidated)             |                                      |                                      |
|--|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|--------------------------------------|
|  | FOR THE QUARTER ENDED 30.06.2023     | FOR THE YEAR ENDED 31.03.2023        | FOR THE QUARTER ENDED 30.06.2022     | FOR THE QUARTER ENDED 30.06.2023     | FOR THE YEAR ENDED 31.03.2023        | FOR THE QUARTER ENDED 30.06.2022     |
| Total income from operations   | 30,644.04                            | 1,01,307.19                          | 21,657.03                            | 31,894.20                            | 1,05,797.30                          | 22,615.88                            |
| Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)  | 7,779.48                             | 29,395.67                            | 5,527.64                             | 8,191.62                             | 31,111.00                            | 5,882.82                             |
| Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)   | 7,779.48                             | 16,905.85                            | 5,527.64                             | 8,191.62                             | 18,621.18                            | 5,882.82                             |
| Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)  | 5,797.10                             | 9,579.68                             | 4,125.26                             | 6,091.35                             | 10,818.45                            | 4,380.59                             |
| Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         | Refer note 1                         |
| Paid-up equity share capital (Face value ₹2/- per share)   | 615.95                               | 615.37                               | 614.29                               | 615.95                               | 615.37                               | 614.29                               |
| Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year  | 1,24,377.87 (As on 31st March, 2023) | 1,24,377.87 (As on 31st March, 2023) | 1,14,411.51 (As on 31st March, 2022) | 1,28,740.25 (As on 31st March, 2023) | 1,28,740.25 (As on 31st March, 2023) | 1,17,495.94 (As on 31st March, 2022) |
| Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)                             |                                      |                                      |                                      |                                      |                                      |                                      |
| - Basic  | 18.83                                | 31.17                                | 13.43                                | 19.79                                | 35.20                                | 14.27                                |
| - Diluted  | 18.75                                | 31.02                                | 13.40                                | 19.70                                | 35.04                                | 14.23                                |
| Securities Premium Account   | 52,060.52                            | 51,893.22                            | 51,587.22                            |                                      |                                      |                                      |
| Net Worth  | 1,23,808.89                          | 1,17,893.38                          | 1,11,265.20                          |                                      |                                      |                                      |
| Outstanding Debts  | 1,72,176.06                          | 1,86,300.04                          | 1,70,605.17                          |                                      |                                      |                                      |
| Outstanding Redeemable Preference Shares   | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |
| Debt Equity Ratio  | 1.31                                 | 1.49                                 | 1.43                                 |                                      |                                      |                                      |
| Capital Redemption Reserve   | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |
| Debenture Redemption Reserve   | Nil                                  | Nil                                  | Nil                                  |                                      |                                      |                                      |

- Note:**
- Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet made applicable to banks.
  - The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank ([www.axisbank.com](http://www.axisbank.com)) and on the Stock Exchange websites ([www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com)).
  - Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.

For and on behalf of the Board

Place: Mumbai  
Date: 26<sup>th</sup> July, 2023

[www.axisbank.com](http://www.axisbank.com)

AMITABH CHAUDHRY  
MD & CEO

**ADD Gel**

LEADERS IN WRITING TECHNOLOGY

REFILLABLE PERMANENT MARKERS

**2-XL**

World's BIGGEST



25% OFF

- DOUBLE INK CAPACITY
- EXTRA BROAD NIB & DARKER WRITING
- MOST ECONOMICAL FOR HEAVY USERS

**XL**

FULL SIZE Marker with Clip



20% OFF

FOR BEST PERFORMANCE: Use "ADD-GEL" PERMANENT Marker Inks  
₹ 25.00/- for (15 ml)

For Bulk & Regular Purchase: [www.shop.addpens.com](http://www.shop.addpens.com)

For Corporate Enquiry: [esales@addpens.com](mailto:esales@addpens.com)



સાયન્સ સિટીમાં યોજાયેલા એકિઝબિશનમાં બે દિવસમાં 8 હજાર મુલાકાત લીધી અમેરિકન કંપની માઈક્રોને એકિઝબિશનમાં સાણંદના પ્લાન્ટ માટે નોકરીઓ ઓફર કરી દુનિયાભરની સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સે પોતાના સ્ટોલ્સ ઊભા કર્યા છે

સાયન્સ સિટીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયાના પ્રદર્શનમાં બુધવારે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ સહિતની વિદ્યાશાખાના યુવક-યુવતીએ ઉત્સાહથી રસ લઈને મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં 8000 તથા બુધવારે અહીં 5200 જેટલા યુવાનોએ અહીં મુલાકાત લીધી હતી. આ એકિઝબિશનની 20 હજાર યુવાનો મુલાકાત લે તેવી ધારણા છે.

સ્ટોલ પર કર્મચારીઓ જોઈએ છે તેવી જાહેરાત મૂકી હતી. માઈક્રોને ગુજરાતમાં સ્થપાનારા પોતાના સાણંદ પ્લાન્ટ થકી બે વર્ષમાં 20 હજાર નોકરીઓ સર્જવાનો દાવો કર્યો છે. આ જાહેરાત જોઈને અનેક યુવક-યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવી નોકરી માટે રસ દાખવ્યો હતો. ફોક્સકોન, માઈક્રોન, એએમડી, આઈબીએમ, માર્વેલ, વેદાંતા, લેમ રિસર્ચ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, એસડી માઈક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ડવૂડ ટેકનોલોજીસ, ઈન્ફિનિયોન ટેકનોલોજીસ, એપ્લાઇડ મટિરિઅલ્સ સહિત કંપનીએ 100થી વધુ સ્ટોલ્સ ઊભા કર્યા છે.



માઈક્રોનના પ્રતિનિધિ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે ગુજરાતમાં સાણંદ ખાતે માઈક્રોને સેમિકન્ડક્ટર પ્લેન્ટ બનાવવાની જાહેરાત કર્યા બાદ તેના વડા સંજય મેહરોત્રા પ્રથમવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તે દરમિયાન તેઓ ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વનટુવન બેઠક યોજવા જઈ રહ્યા છે. તેઓ માઈક્રોનના પ્લાન્ટ અને રોજગાર સર્જન અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે.

સરકારે ડિજિટલ વિશેષાંકનું અનાવરણ કર્યું પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા પછી કારકિર્દી વિશેષાંક યાદ આવ્યો! મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ

રાજ્યમાં ડિગ્રી ઈજનેરી, મેડિકલ સહિતના વ્યાવસાયિક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાના આરંભે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કારકિર્દીના પંથે-2023 ડિજિટલ વિશેષાંકનું અનાવરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નવીન પહેલના ભાગરૂપે રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિ નિર્માણમાં સહાયક અને માર્ગદર્શક બને એવા ઉદ્દેશથી 'કારકિર્દીના પંથે-2023' ડિજિટલ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરના હસ્તે અને રાજ્યકક્ષાના મંત્રી

પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત તૈયાર કરેલો આ ડિજિટલ વિશેષાંક પીડીએફ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં પહોંચાડવામાં આવશે. ઉપરાંત ક્યુઆરકોડ સ્કેન કરી પ્રાપ્ત કરી શકાશે. શિક્ષણ મંત્રી ડિંડોરે કહ્યું હતું કે, વિશેષાંક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કારકિર્દીનું સાચું માર્ગદર્શન પુરું પાડી જ્ઞાનમાં વૃદ્ધિ કરશે. જે કારકિર્દી અને વ્યવસાયનું માર્ગદર્શન પુરું પાડી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો આધારસ્તંભ બનશે. આ અંક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાચી માહિતી મળે તેટલા માટે તૈયાર કરવામાં આવ્યો છે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં પાટીલે 80 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ પાટીલને ધમકી આપીને 8 કરોડની ખંડણી માગનારા યુવકની ધરપકડ પ્રદેશ પ્રમુખ અને ભાજપ અંગે ખરાબ ટીપ્પણી કરી હોવાની ફરિયાદ

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને તેના એક માણસે રૂા. 80 કરોડ ચાંઉ કર્યા હોવાના આક્ષેપ સાથે વીડિયો વાઈરલ કરનાર યુવકની સામે સુરત કાર્થમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી સાથે જ તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભટારમાં રહેતા સની ઠક્કરે કાર્થમ બ્રાન્ચમાં જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ જિનેન્દ્રએ 30 ઓગસ્ટ 2022ના રોજ વોટ્સએપમાં એક વીડિયો

વિવાદ ઘુંઘટો? એક વીડિયોમાં જિનેન્દ્ર શાહએ કહ્યું હતું કે સી. આર. પાટીલે સુંધાર્યું મહત્તા સાથે મળીને ચૂંટણી માટે 80 કરોડ એકત્ર કરીને લોકોને આપ્યા ન હતા. સાથે સાથે સી.આર. પાટીલ જ્યારે કોન્સ્ટેબલ હતા ત્યારથી લઈને અત્યાર સુધીના જીવનચરિત્રને લઈને અપશબ્દો તેમજ ભાજપ વિશે પણ ખરાબ ટીપ્પણી કરવામાં આવી હતી.

ફરતો કર્યો હતો. આ વીડિયોમાં જિનેન્દ્રએ ગુજરાતમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા

મેડિકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો પાછો ખેંચો: કોંગ્રેસ

ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર

ગુજરાત સરકારની જીએમઈઆરએસ સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં જનરલ ક્વોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં 88 ટકા તેમજ એનઆરઆઈ ક્વોટામાં 3 હજાર ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને પાછો ખેંચવો જોઈએ તેવી માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી હતી. પ્રદેશ પ્રમુખ ગોહિલે કહ્યું હતું કે, ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિસ સહિતના મેડિકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટા પાયે ઘટ છે. ગુજરાતમાં મેડિકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવાનું તેમનું સપનું માત્ર સપનું જ રહી જશે.

મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ ગુરુને બદલે શુક્રવારે યોજાશે

ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર મહિનાના ચોથા ગુરુવારે સામાન્ય નાગરિકોની રજૂઆતો-ફરિયાદો સાંભળવા માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાય છે, પણ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોવાથી તેઓ ગુરુવારના રોજ યોજાતો આ કાર્યક્રમ શુક્રવારે 28 જુલાઈના રોજ યોજવામાં આવશે.

Advertisement for Gujarat G20 Development Corporation Limited (G20). Includes text about the company, its services, and contact information. Also includes a list of directors and their details.

Advertisement for mgmd.gov.in featuring a QR code, a quote from Prime Minister Narendra Modi, and information about the government portal. Includes the text 'સંસ્કૃતિ પર ગર્વ, વારસા થી પ્રેરણા' and 'મારૂં ગામ મારી ઘરોહર પોર્ટલ'.

Advertisement for Axis Bank Ltd. featuring financial results for the quarter ended 30th June 2023. Includes a table with financial data and a quote from the CEO, Amitabh Chaudhry.